



DF-002-001510

Seat No. _____

B. Com. (Sem. V) (CBCS) Examination

March – 2022

Business Management - 5

(Financial Management) (Old Course)

Faculty Code : 002

Subject Code : 001510

Time : 2½ Hours]

[Total Marks : 70

સૂચના : જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ સૂચવે છે.

1 નાણાકીય સંચાલનનો અર્થ, ઉદ્દેશો અને મહત્ત્વ સમજાવો. 20

અથવા

1 નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર અને વિવિધ નાણાં કાર્યો સમજાવો. 20

2 નાણાકીય પત્રકોનો અર્થ અને ઉપયોગિતા સમજાવો અને તેના વિશ્લેષણની વિવિધ પ્રયુક્તિઓ વિશે ટૂંકમાં સમજૂતી આપો. 20

અથવા

2 ગુણોત્તર વિશ્લેષણનો અર્થ, ઉપયોગિતા અને વિવિધ પ્રકારના ગુણોત્તરોનું વર્ગીકરણ આપો. 20

3 મૂડી બજેટ ઘડતર એટલે શું ? તેના હેતુઓ - મહત્ત્વ અને પ્રક્રિયા ચર્ચો. 15

અથવા

3 ટૂંકનોંધ લખો : (કોઈ પણ ત્રણ) 15

- (1) પરત આપ સમય પદ્ધતિ
- (2) સરેરાશ વળતર દર પદ્ધતિ
- (3) ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ
- (4) લાભ-ખર્ચ ગુણોત્તરની પદ્ધતિ
- (5) આંતરિક વળતર દર પદ્ધતિ.

4 મૂડી બજેટિંગ સંદર્ભે જોખમ વિશ્લેષણ અને વિવિધ પ્રકારના જોખમો વિશે સમજૂતી આપો. 15

અથવા

- 4 વેનચર કેપીટલ (સાહસી મૂડી) અંગે પ્રારંભિક જાહેર ઓફર (IPO) અને ગૌણ જાહેર ઓફર (SPO) અંગે સમજૂતી આપો. 15

ENGLISH VERSION

Instruction : Figures to the right side indicate marks.

- 1 Explain meaning, goals and importance of Financial Management. 20

OR

- 1 Explain scope of Financial Management and various Finance functions. 20

- 2 Explain meaning and utility of Financial statements and give brief explanation of different techniques for analysis of Financial statements. 20

OR

- 2 Give meaning, utility of Ratio analysis and classification of various types of Ratios. 20

- 3 What is capital Budgeting ? Discuss its objectives, importance and process. 15

OR

- 3 Write short notes : (any three) 15

- (1) Pay-back period method
- (2) Average rate of return method
- (3) Net present value method
- (4) Cost benefit ratio method
- (5) Internal rate of return method.

- 4 Explain risk analysis in regards to capital budgeting and different types of risks. 15

OR

- 4 Give explanation of Initial Public Offer (IPO) and Secondary Public Offer (SPO) in regards to venture capital. 15